



Accredited Grade "B" by NAAC

# SAURASHTRA UNIVERSITY

## EXAM SECTION - 02

University Campus, University Road, Rajkot – 360005  
Phone No.: (0281) 2576511 Ext. No. 734-301 / FAX No.: (0281) 2586411  
E-mail Id: exam02@sauuni.ac.in

### પરિપત્ર:-

વિષય:- C.B.C.S. (ચોઈસ બેઇઝ કેડીટ સિસ્ટમ) પધ્ધતિ અંતર્ગત અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર-૦૨ ની પરીક્ષાઓ માટે ઇન્ટરનલ ગુણની ઓનલાઈન એન્ટ્રી કરવા અંગે.

સંદર્ભ: નં./પરીક્ષા/૦૨/૧૬૦/૨૦૨૧ તા.૧૪/૦૨/૨૦૨૧

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્થિત અનુસ્નાતક ભવનોના અધ્યક્ષશ્રી તથા માન્ય અનુ. સંસ્થાઓના વડાઓને જણાવવાનું કે, સંદર્ભ દર્શિત પરિપત્રથી ઇન્ટરનલ માર્ક્સની એન્ટ્રી માટે તારીખ ફિક્સ કરવામાં આવેલ છે પરંતુ હાલની કોવિડ-૧૯ ની પરિસ્થિતિ ને ધ્યાને લઈ સંદર્ભિત પરિપત્ર ની હાલ પુરતી અમલવારી શક્ય ન હોય C.B.C.S. (ચોઈસ બેઇઝ કેડીટ સિસ્ટમ) પધ્ધતિ અંતર્ગત અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર-૦૨ ની પરીક્ષાઓનાં ઇન્ટરનલ ગુણની ઓનલાઈન એન્ટ્રી ભવન/અનુ.સંસ્થા દ્વારા કરવાની રહેશે આ માટે ઓનલાઈન એન્ટ્રી પ્રારંભ થવાની તારીખ તેમજ પૂર્ણ થવાની તારીખ નીચે મુજબ છે.

પ્રારંભ થવાની તારીખ	૧૩/૦૭/૨૦૨૧
પૂર્ણ થવાની તારીખ	૨૩/૦૭/૨૦૨૧

### અગત્યની સુચનાઓ :

- ઉપર્યુક્ત છેલ્લી તારીખ બાદ કરવામાં આવતી એન્ટ્રી સોફ્ટવેર પ્રોગ્રામ સ્વીકારશે નહીં, જે ધ્યાને લેવા વિનંતી છે.
- ઇન્ટરનલ માર્ક્સ ની એન્ટ્રી પૂરી થયા બાદ ભવન/અનુ.સંસ્થાએ ચેકલીસ્ટની પ્રિન્ટની ખરાઈ કરી લેવાની રહેશે, છેલ્લી તારીખ બાદ સુધારો શક્ય બનશે નહીં.
- ઇન્ટરનલ માર્ક્સ ની એન્ટ્રી પૂર્ણ થયા બાદ જો કોઈ ભૂલ હોય તો જરૂરી સુધારો કરી, ચેક લીસ્ટની પ્રિન્ટ કાઢી તેની ખરાઈ કરી તેમાં ભવન/અનુ.સંસ્થાના વડાએ સહી-સિક્કા સાથે સર્ટીફાઇડ કરીને ભવન/અનુ.સંસ્થાના રેકોર્ડ ઉપર રાખવાની રહેશે. યુનિવર્સિટીને જરૂર જણાય તો મંગાવે ત્યારે ભવન/અનુ.સંસ્થાના વડાના સહી સિક્કા સાથેની નકલ પરીક્ષા વિભાગમાં જમા કરાવવાની રહેશે.
- યુનિવર્સિટી દ્વારા પરિણામ જાહેર થયા બાદ કોઈ પણ સંજોગોમાં ઇન્ટરનલ માર્ક્સમાં યુનિવર્સિટી દ્વારા ફેરફાર કરી દેવામાં આવશે નહિ.
- ઇન્ટરનલ ગુણ ની એન્ટ્રી દરમ્યાન ભવન/અનુ.સંસ્થાના વડાને USERNAME તથા PASSWORD અપાયેલ છે તેનો જ ઉપયોગ કરવો અને તે માહિતી લીક ના થાય તે અંગેની સંપૂર્ણ જવાબદારી જે-તે ભવન/અનુ.સંસ્થાના વડાની રહેશે જે વિદિત થાય.

પરિસ્થિતિ સામાન્ય થતા સંદર્ભદર્શિત પરિપત્ર રાખેતામુજબ યથાવત રહેશે.

ઉપર મુજબની જાણ ભવન/અનુ.સંસ્થાના સંબંધિત સર્વેને કરવાની રહેશે અને જરૂરી વ્યવસ્થા ગોઠવવા યોગ્ય કરશોજી.

*Winghi*  
પરીક્ષા નિયામક

નં./પરીક્ષા/૦૨/૫૨૫/૨૦૨૧ તા. ૧૦/૦૭/૨૦૨૧

પરીક્ષા વિભાગ-૦૨, સૌ.યુનિ. રાજકોટ.-૩૬૦૦૦૫

૦૧. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્થિત તમામ અનુસ્નાતક ભવનોનાં અધ્યક્ષશ્રીઓ તરફ.....

૦૨. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માન્ય અનુ.સંસ્થા ના વડા તરફ.....

નકલ રવાના: (જાણ સારૂ તથા યોગ્ય થવા અર્થે)

૦૧. માન. કુલપતિશ્રી/કુલનાયકશ્રી/કુલસચિવશ્રીનાં અંગત સચિવશ્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.

૦૨. હિસાબ વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.

૦૩. ઓડીટ વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.

૦૪. પરીક્ષા વિભાગ – ૦૧, ૦૩, ૦૪, ૦૫, પરીક્ષા સેલ તથા પરીક્ષા કોમ્પ્યુટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.